

કેસ રજુ તા. ૨૦-૦૩-૧૨
દાખલ તા. ૨૦-૦૩-૧૨
ફેસલ તા. ૨૨-૦૨-૧૮
અવધિ:- વર્ષ માસ દિવસ

વલસાડના મે. પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ સાહેબની કોર્ટમાં,

મુ. વલસાડ.

સ્પે. દિ. મુ. નં. ૩૯ - ૨૦૧૨

આંક -

વાદી:- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
કોસંબા બ્રાંચ, તા. જી. વલસાડ.

વિરુદ્ધ

પ્રતિવાદીઓ:- (૧) શ્રી રામવિલાસ બલેશ્વર શુક્લા,
ઉ.વ.આ. જર, ધંધો - વેપાર,
ફ્લેટ નં. ૩૦૪, રામેશ્વર એપાર્ટમેન્ટ,
અતુલ રોડ, પારનેરા પારડી, તા. જી. વલસાડ.
(૨) બ્રાંચ મેનેજર, સ્ટેટ બેંક ઓફ પટીયાલા,
ચલા-દમણ રોડ, વાપી. (આંક-૭૩ મુજબ ડીલીટ)

વાદી તરફ - વિ.વ.શ્રી એમ. આર. પ્રણામી
પ્રતિવાદી નં ૧ તરફ - એક તરફી

દાવો:- ૩.૭,૫૫,૭૯૦/- પુરા વસુલ લેવાનો માટેનો ...

- ચુકા દો -

૧.) વાદીના દાવાની ટુંકમા રજુઆત એવી છે કે, વાદી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૫૫ હેઠળ સ્થપાયેલી બેંકીંગનો ધંધો કરતી સંસ્થા યાને કોર્પોરેટ બોડી છે. વાદી .

બેંકીંગનું કામકાજ કરવાનો ઇંધો કરે છે. વાદી બેંકની કોસંબા શાખા, વલસાડના બ્રાંચ મેનેજરશ્રી રાજેશ પટેલને હાલનો દાવો કરવા, દાવા અરજી તથા અન્ય જરૂરી કાગળો ઉપર સહી સિક્કા કરવા તથા આ દાવા અંગેની તમામ જરૂરી તજવીજો કરવા વાદી બેંકે સંપૂર્ણ અધિકાર આપેલો છે. વાદી તેમની દાવા અરજીમાં વધુમાં જણાવે છે કે, આ કામના પ્રતિવાદી નં. ૧ નાએ ઇનોવા કાર ખરીદવા માટે નાણાંની જરૂર પડેલી. આથી તેઓ વાદી બેંકની કોસંબા શાખા, વલસાડમાં આવેલા અને તે અંગેના પ્રતિવાદી નં. ૧ નાએ જરૂરી કાગળો રજૂ કરેલા. આથી વાદી બેંકે પ્રતિવાદી નં. ૧ ને રૂ.૬,૫૦,૦૦૦/- ના ટર્મલોનના ધીરાણની સગવડ આપેલી. જે લીધા બદલ તથા શરતો મુજબ પરત આપવા પ્રતિવાદી નં. ૧ એ બેંકના નિયમ મુજબ કાયદેસરના તમામ જરૂરી લખાણો લખી આપી પોતાની સહીઓ જરૂરી તમામ જગ્યાએ કરી આપેલી અને વાદી બેંકના લેણાં થતાં તમામ રૂપીયા વ્યાજ સાથે શરતો મુજબ પરત કરવા વિશ્વાસ, ભરોસો તથા ખાત્રી આપેલી. પરંતુ પ્રતિવાદી નં. ૧ હાયપોથીકેશન એગ્રીમેન્ટ મુજબ વાદી બેંકમાંથી મેળવેલ લોન આધારે ખરીદેલ વાહનની આર.ટી.ઓ.બુકમાં વાદી બેંકની તરફેણમાં લિયન નોંધાવવાની શરતનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલા તેમજ આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન બુકની નકલ વાદી બેંકમાં જમા કરાવેલ નહીં કે ઇન્સ્પેક્શન માટે વ્હીકલ રજૂ કરેલ નહીં કે વાહનની ઇન્શયોરન્સ પોલીસમાં વાદી બેંકના હાયપોથીકેશન ચાર્જની નોંધણી કરાવેલી નહીં. વાદી બેંક સાથે થયેલ હાયપોથીકેશન એગ્રીમેન્ટની શરતોનું પાલન કરવામાં પ્રતિવાદી નં. ૧ નિષ્ફળ ગયેલા.

૨.) વાદી બેંકના જે તે સમયના અધિકારીઓએ પ્રતિવાદી નં. ૧ વગેરેનું ધ્યાન દોરી શરત મુજબ વર્તન કરી વાદી બેંકના રૂપીયા તથા વ્યાજની રકમ ભરપાઈ કરવા તાકીદ કરેલી. તેમ છતાં પ્રતિવાદી નં. ૧ વગેરેએ પોતાનું વર્તન સુધારેલું નહીં અને શરત ભંગ ચાલુ રાખેલો. પ્રતિવાદી નં. ૧ એ વાદી બેંકમાંથી વાહન ખરીદવા માટે મેળવેલ લોનથી વાહન ખરીદેલ નહીં અને તે લોનની રકમનો દુરુપયોગ કરેલો. જેથી વાદી બેંક, પ્રતિવાદી નં. ૧ ની સ્થાવર-જંગમ મિલકતમાંથી બાકી લેણી રકમ વસૂલવા હકદાર છે. જે બાકી રકમ

વ્યાજ સહિત વસૂલ મેળવવા વાદીએ આ દાવો દાખલ કરેલ છે. વાદી બેંકે વકીલશ્રી મારફતે પ્રતિવાદી નં. ૧ ને નોટીશ આપેલી. જેનો અમલ કરવામાં પ્રતિવાદી નં. ૧ સદંતર નિષ્ફળ ગયેલા છે અને વાદી બેંકની દાવાવાળી રકમ આજે પણ બાકી પડે છે. પ્રતિવાદી નં. ૧ ના વાદી બેંક સાથેના દાવાવાળા વ્યવહારની વિગત જુદી ચાદી સાથે રજુ કરેલા દસ્તાવેજોમાં વિગતવાર જણાવેલી છે. આમ, વાદીએ દાદ માંગેલ છે કે, એકંદરે રૂ.૭,૫૫,૭૮૦/- (અંકે રૂપિયા સાત લાખ પંચાવન હજાર સાતસો નેવું પુરા) તથા આ દાવાનો તમામ ખર્ચ, દાવા તારીખથી રકમ વસૂલ થતાં સુધીના સમય માટેનું દર વર્ષે ૧૧.૭૫ ટકાના વ્યાજ સાથે પ્રતિવાદી નં. ૧ ની તમામ પ્રકારની સ્થાવર જંગમ તથા અન્ય માલ મિલકતથી તથા પ્રતિવાદી નં. ૧ ની જાતથી વસૂલ લેવાનું હુકમનામું વાદી બેંકના લાભમાં આ કામના તમામ પ્રતિવાદી નં. ૧ વિરુદ્ધ કરી આપશોજી.

૩.) આ કામે પ્રતિવાદીઓને ધોરણસર સમન્સની બજવણી કરતાં, પ્રતિવાદી નં. ૨ તરફે આંક-૨૪ થી પોતાનો લેખિત જવાબ રજુ કરેલ છે. જેમાં તેમણે વાદીના દાવાની હકીકતોને સમર્થન આપી પ્રતિવાદી નં. ૧ સાથે તેમને કાંઈ લાગતું વળગતું નથી, તેમ જણાવેલ છે. વધુમાં વાદીએ પ્રતિવાદી નં. ૨ તરીકે જોડેલ સ્ટેટ બેંક ઓફ પતિયાલા તરીકે જોડેલ. સદર બેંક કેન્દ્ર સરકારશ્રીના નોટીફિકેશન મુજબ વાદી બેંકમાં મર્જ થતાં સ્ટેટ બેંક ઓફ પતિયાલાનું અસ્તિત્વ રહેલ ન હોય અને તેના તમામ દેવા - લેણાં તથા અસ્કયામતો સાથે વાદી બેંકમાં મર્જ થયેલ હોય, આંક-૭૩ લગત કરવામાં આવેલ હુકમ મુજબ પ્રતિવાદી નં. ૨ ને ડીલીટ કરવામાં આવેલ છે અને તેમની સામેની દાદ રદ કરેલ છે. જ્યારે આ કામે પ્રતિવાદી નં. ૧ ને જાહેર સમન્સથી પ્રસિધ્ધ કરી સમન્સ બજવણી કરેલ છે, પરંતુ તેઓ તરફે કોઈ હાજર થયેલ નથી કે વાદીની દાવા અરજી વિરુદ્ધ પોતાનો જવાબ રજુ કરેલ નથી. જેથી મારા પુરોગામી ન્યાયધિશ્રીએ તા.૨૭-૦૧-૨૦૧૬ ના રોજ પ્રતિવાદી નં. ૧ વિરુદ્ધ હાલનો દાવો એક તરફી આગળ ચલાવવાનો હુકમ કરવામાં આવેલ છે.

જ.) વાદીની દાવા અરજી તથા રજુ કરેલ દસ્તાવેજ પુરાવા અને કાયદાકીય જોગવાઈ ધ્યાને લેતાં, આ દાવાના કામે મારા પુરોગામી ન્યાયધિશશ્રીએ આંક-૫૩ થી તા.૨૩-૦૮-૨૦૧૬ ના રોજ નીચે મુજબના મુદ્દાઓ કાઢેલ છે.

-મુદ્દાઓ-

1. Whether Plaintiff proves that the plaintiff is entitled to recover Rs.7,55,790/- from the defendant No. 1 ?
2. Whether plaintiff is entitled for interest? If yes, which rate?
3. Whether plaintiff proves that Defendant No. 2 has also liable with Defendant No. 1 for repayment of loan amount?
4. Whether Defendant No. 2 proves that they have not committed any lapses for financial transaction between Plaintiff bank and Defendant No. 1 ?
5. Whether plaintiff is entitled for relief seeking in Plaint ?
6. What Order and Decree ?

ઉપરોક્ત મુદ્દાઓ અંગેના મારા નિર્ણયો તેના કારણો સહિત નીચે મુજબ છે.

૧. હકારમાં.
૨. અંશતઃ હકારમાં.
૩. પ્રતિવાદી નં. ૨ ને તથા તેમની સામેની દાદ ડીલીટ કરેલ હોય જવાબ આપેલ નથી.
૪. પ્રતિવાદી નં. ૨ ને તથા તેમની સામેની દાદ ડીલીટ કરેલ હોય જવાબ આપેલ નથી.

પ. અંશતઃ હકારમાં.

૬. આખરી હુકમ મુજબ.

પ.) વાદી તરફે નીચે મુજબનો મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ છે.

વાદી તરફે મૌખિક પુરાવો:-

૧. આંક-૬૦ થી સાહેદ ભાવેશ ડી. ઠક્કરનુ સોગંદનામુ

વાદી તરફે દસ્તાવેજી પુરાવાઓ:-

૧. આંક-૬૧ થી લોન એપ્લીકેશન.
૨. આંક-૬૨ થી પ્રતિવાદી નં. ૧ નો ટુંકો અભિપ્રાય.
૩. આંક-૬૩ થી એગ્રીમેન્ટ લેટર.
૪. આંક-૬૪ થી લોન કમ હાઇપોથીકેશન એગ્રીમેન્ટ.
૫. આંક-૬૫ થી અંડરટેકીંગ.
૬. આંક-૬૬ થી કન્સેન્ટ કલોઝ.
૭. આંક-૬૭ થી પ્રતિવાદીની સહી સાથે વાહનની વીગતની ચાદી.
૮. આંક-૬૮ થી પ્રતિવાદી નં. ૨ ને આપેલ લીગલ નોટીશ.
૯. આંક-૬૯ થી પોસ્ટલ રીસીપ્ટ.
૧૦. આંક-૭૦ થી પોસ્ટલ એકનોલેજમેન્ટ.
૧૧. આંક-૭૧ થી સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ સર્ટીફાઇડ ઉતારો.

૬.) આ કામે આંક-૭૫ થી વાદી તરફે વધુ પુરાવા રજુ ન કરવા અંગેની કલોઝીંગ પુરસીસ રજુ થયેલ છે.

મુદ્દા નં. ૧,૨,૫,૬ -

૭.) આ કામે વાદી બેંકની રજુઆત છે કે, પ્રતિવાદી નં. ૧ કે જેઓએ વાદી બેંક પાસેથી ઇનોવા કાર ખરીદવા માટે ટર્મ લોન મેળવેલી તે અંગે શરૂઆતથી જ પ્રતિવાદી નં. ૧ લોનની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલ. પ્રતિવાદી નં. ૧ નાએ બેંકની તરફેણમાં જરૂરી દસ્તાવેજો સહી કરીને આપેલા. પરંતુ પ્રતિવાદી નં. ૧ તે ટર્મલોનની બાકી રકમની ચુકવણીમાં નિષ્ફળ જતાં વાદીને હાલનો દાવો દાખલ કરવાની ફરજ પડેલ છે.

૮.) આ કામે વાદીના સાહેદનું આંક-૬૦ નું સોગંદનામું ધ્યાને લેતાં તેમણે પોતાની દાવા અરજીમાં જણાવેલ તમામ હકીકતોનું પુનરાવર્તન કરેલ છે. વાદીની દાવા અરજીને પ્રતિવાદી નં. ૧ એ તેમના લેખિત જવાબ કે દલીલો દ્વારા પડકારવામાં આવેલી નથી. જેથી આ કામે વાદીએ તેમની દાવા અરજી અને સોગંદનામામાં જણાવેલ તમામ હકીકતો અને રજુ કરેલા દસ્તાવેજો પુરાવાઓ વાદીના લાભમાં પુરવાર થયેલાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. વધુમાં આ કામે વાદી તરફથી રજુ થયેલા દસ્તાવેજો પુરાવાઓ પરથી તે પુરવાર થાય છે કે, પ્રતિવાદી નં. ૧ નાએ ઇનોવા કારની ખરીદી માટે વાદી બેંક પાસેથી લોન લીધેલી અને તે અંગે જરૂરી દસ્તાવેજોમાં સહી કરેલી. આ કામે પ્રતિવાદી નં. ૧ નાએ તા.૧૮-૧૨-૨૦૦૯ ના રોજ રૂ.૬,૫૦,૦૦૦/- ની લોન મેળવેલી. પ્રતિવાદી નં. ૧ એ ભરપાઈ કરેલ રકમ તથા ચઢેલ વ્યાજ ઉમેરતાં રૂ. ૭,૫૫,૭૯૦/- બાકી લેણાં થાય છે. જેથી વાદી આ કામના પ્રતિવાદી પાસેથી દાવા અરજીની દાદમાં માંગ્યા મુજબની રકમ રૂ.૭,૫૫,૭૯૦/- મેળવવા હક્કદાર થતા હોવાનું પુરવાર થાય છે. જેથી મુદ્દા નં. ૧ નો જવાબ હકારમાં આપવામાં આવે છે.

૯.) આ કામે પ્રતિવાદી નં. ૧ નાએ તેના તરફે કોઈ પુરાવો વાદી બેંકની વિરુદ્ધમાં રજુ કરેલ નથી કે કોઈ બચાવ લીધેલ નથી. તેથી વાદી બેંકે પ્રતિવાદી નં. ૧ ને ધીરાણ

આપેલ તે હકીકત વાદી તરફે રજૂ પુરાવાથી સાબિત થાય છે. વાદી બેંકે સમયાંતર પ્રવર્તમાન વ્યાજના દર મુજબ વ્યાજની ગણતરી કરેલ છે. વાદી અને પ્રતિવાદી નં. ૧ વચ્ચે ૧૧.૭૫ ટકા મીનીમમ વ્યાજ ચુકવવાનો કરાર છે. સી.પી.સી.ની કલમ - ૩૪ ને ધ્યાને રાખતાં વાદી બેંકને દાવા તારીખથી હુકમનામા તારીખ સુધી બાકી રકમ રૂ.૭,૫૫,૭૯૦/- ઉપર ૧૧.૭૫ % ટકાના વાર્ષિક દરે વ્યાજ મેળવવા હક્કદાર છે તેવું નિર્ણિત કરવામાં આવે તેમજ હુકમનામા બાદથી વસૂલ મળતાં સુધી બાકી રકમ રૂ.૭,૫૫,૭૯૦/- ઉપર ૬ ટકા વ્યાજ વાદી મેળવવા હક્કદાર છે તેવું નિર્ણિત કરવામાં આવે તો ન્યાયનો હેતુ જળવાય તેમ છે. તેથી વાદી બેંક બાકી રકમ ઉપર દાવા તારીખથી હુકમનામા તારીખ સુધી લેણી રકમ ઉપર ૧૧.૭૫ ટકાના દરે અને હુકમનામા તારીખ બાદ વાર્ષિક ૬ ટકાના સાદા વ્યાજના દરે વ્યાજ મેળવવા હક્કદાર છે. તેમ ઠરાવી મુદ્દા નં. ૨ અને ૫ નો જવાબ અંશતઃ હકારમાં ઠરાવી મુદ્દા નં. ૬ અન્વયે નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે.

- હુકમ -

૧. વાદીનો દાવો અંશતઃ મંજૂર કરવામાં આવે છે.
૨. બાકી લેણી રકમ રૂ.૭,૫૫,૭૯૦/- દાવા તારીખથી હુકમનામા તારીખ સુધી ૧૧.૭૫ ટકા સાદા વ્યાજના દરે તથા સદર રકમ રૂ.૭,૫૫,૭૯૦/- પૈસા વસૂલ મળતા સુધી ૬ % ના સાદા વ્યાજ સહિત વાદી, પ્રતિવાદી નં. ૧ ની સ્થાવર જંગમ મિલકતો, પ્રતિવાદી નં. ૧ ની જાત તથા અન્ય મિલકતોમાંથી વસૂલ મેળવવા હક્કદાર હોવાનું ઠરાવવામાં આવે છે.
૩. વાદીના દાવાનો ખર્ચ પ્રતિવાદી નં. ૧ એ ભોગવવો.

૪. હુકમ મુજબ હુકમનામુ દોરવુ.

હુકમ આજરોજ તા. ૨૨, ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ ખુદી અદાલતમાં વાંચી
સંભળાવી જાહેર કર્યો.

તા. ૨૨-૦૨-૨૦૧૮
મુ. વલસાડ.

(હેમાંસુ અમૃતલાલ ભૂતવાલા)
પ્રિન્સીપાલ સીની. સીવીલ જજ,
જી. વલસાડ. (જી.જે.૦૦૮૮૩)